

# LORDS ISHWAR HOTELS LIMITED

CIN : L55100GJ1985PLC008264

To,

31<sup>st</sup> May, 2023

**BSE Limited**

Department of Corporate Service,  
Phiroze Jeejeebhoy Towers,  
Dalal Street,  
Mumbai - 400 001

**Sub.: Newspaper advertisements copy of Audited Financial Results**

Ref: BSE Code - 530065

Dear Sir,

Please find enclosed herewith the Newspapers advertisements copy of Statement of Standalone Audited Financial Results for the quarter and year ended on 31<sup>st</sup> March, 2023 published in Financial Express (English & Gujarati Edition) in terms of Regulation 33 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Kindly take the same on your record.

Thanking you.

Yours faithfully,

For LORDS ISHWAR HOTELS LIMITED

DARSHANA LADDHA  
Company Secretary  
Membership No.: A57289



Encl.: As above.



<b>INTERWORLD DIGITAL LIMITED</b> CIN: L72900DL1995PLC067808 Regd. Off: 701, Anurachal Building, 19, Barakhamba Road, Connaught Place, New Delhi- 110001 Tel. No.: 011-43571044-45 Fax No.: 011-43571047 Website: www.interworlddigital.in Email: interworlddigital@gmail.com <b>EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS</b> <b>FOR THE QUARTER AND FINANCIAL YEAR ENDED 31ST MARCH, 2023</b> (Rs. in Lacs)					
Sr. No.	Particulars	Quarter ended 31.03.2023 (Audited)	Quarter ended 31.03.2023 (Audited)	Year ended 31.03.2023 (Audited)	Year ended 31.03.2023 (Audited)
1	Total income from operations	1.01	1.80	5.94	9.42
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	-4.66	-10.52	-18.85	-9.49
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	-4.66	-3188.02	-18.85	-3811.40
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	-4.66	-3145.83	-18.85	-3769.21
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	-4.66	-3145.83	-18.85	-3769.21
6	Equity Share Capital	4,783.77	4,783.77	4,783.77	4,783.77
7	Earnings Per Share (of Rs. 1/- each) (for continuing and discontinued operations)	(0.00)	(0.66)	(0.00)	-0.79
8	Reserves excluding Revaluation Reserves	(0.00)	(0.66)	(0.00)	-0.79
			3,592.57	3,592.57	3,592.57

Note: The above is an extract of the detailed format of Audited Financial Results for the Quarter and Financial Year ended March 31, 2023 filed with the BSE under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the aforesaid Financial Results is available on the BSE's websites, viz., [www.bseindia.com](http://www.bseindia.com), and on the Company's website [www.interworlddigital.in](http://www.interworlddigital.in)

For and on behalf of the Board of Directors of Interworld Digital Limited  
Sd/-  
Peeyush Kumar Aggarwal  
Director  
DIN: 00090423

<b>LORDS ISHWAR HOTELS LIMITED</b> Reg. Off: Hotel Revival, Near Sayaj Garden, Kalagatha Chowk, University Road, Baroda, Gujarat 390022 Tel: 0265 2793545 CIN: L55100GJ1985PLC008264 E-mail: info@lordsiswar.com Website: www.lordsiswar.com				
<b>Extract of Statement of Standalone Audited Financial Results</b> <b>for the Quarter and Year Ended 31st March, 2023</b> (Rs. in Lac)				
Sr. No.	Particulars	Quarter ended 31.03.2023 (Audited)	Quarter ended 31.03.2023 (Audited)	Quarter ended 31.03.2023 (Audited)
1	Total income from operations	201.08	741.77	160.00
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(5.12)	23.43	4.78
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	(5.12)	23.43	4.78
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(9.38)	11.35	20.02
5	Total comprehensive income for the period (comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	(7.73)	13.00	20.02
6	Equity Share Capital	747.00	747.00	747.00
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	--	(241.47)	--
8	Earnings per equity share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	(0.13)	0.15	0.27
	1. Basic:	(0.13)	0.15	0.27
	2. Diluted:	(0.13)	0.15	0.27

Note: The above is an Extract of the detailed format of unaudited Financial Results for the quarter and year ended 31st March, 2023 filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The full Format of the said results is available on website of BSE Limited i.e. [www.bseindia.com](http://www.bseindia.com) & on the Company's Website viz. [www.lordsiswar.com](http://www.lordsiswar.com).

For LORDS ISHWAR HOTELS LIMITED  
Sd/-  
PUSHPENDRA BANSAL  
Managing Director (DIN: 00086343)

<b>APOLLO INVESTMENTS LIMITED</b> Regd. Office : 33, Brabourne Road, 8th Floor, Kolkata - 700001, Tel.: 033-2243 4176, Website: www.apolloinvestments.in, Email: apolloinvestmentsid@gmail.com CIN: L65939WB1983PLC035758				
<b>EXTRACT OF STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS</b> <b>FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2023</b> (₹ in Lakhs)				
S. No.	Particulars	Quarter ended 31/03/23 (Audited)	Year ended 31/03/23 (Audited)	Quarter ended 31/03/22 (Audited)
1	Total income from operations (net)	0.52	162.20	2.70
2	Net Profit / (Loss) for the quarter/year (before Tax, Exceptional and/or Extraordinary Items)	(4.19)	83.66	(3.03)
3	Net Profit / (Loss) for the quarter/year before tax (after Exceptional and/or Extraordinary Items)	(4.19)	83.66	(3.03)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(21.53)	66.32	(3.03)
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(292.16)	(204.31)	151.61
6	Equity Share Capital	24.00	24.00	24.00
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year		1,923.81	
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)- Basic :	(8.97)	27.63	(1.26)
	Diluted :	(8.97)	27.63	(1.26)

NOTES:  
a) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity [www.apolloinvestmentsid.in](http://www.apolloinvestmentsid.in)  
b) Ind AS compliant Financial results for the quarter and year ended March 31, 2023 were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meetings held on May 30 2023.

For and on behalf of the Board of Directors  
Sd/- **PRADPEE KUMAR SINGHANIA**  
Managing Director  
DIN: 00377907

<b>FORM G</b> <b>ADDENDUM NO. II TO INVITATION FOR EXPRESSION OF INTEREST DATED 10.04.2023</b> (Under Regulation 33(a) of the Insolvency and Bankruptcy (Insolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016)	
<b>RELEVANT PARTICULARS</b>	
1. Name of the corporate debtor along with PAN/ CIN/ LLP No.	Vijaygroup Housing Private Limited CIN: U45400MH2009PPLC197737
2. Address of the registered office	205, Marine Chambers, 43, New Marine Lines, Mumbai - 400020
3. URL of website	<a href="http://www.vijaygroup.com/vijayestate/">http://www.vijaygroup.com/vijayestate/</a> (Not Updated)
4. Details of the place where the majority of fixed assets are located	Vijay Estate, Village Vajras, Taluka, Karjat, District Raigad.
5. The installed capacity of main products/ services	Real Estate Project with approximately 83 acres of land with potential for development.
6. Quantity and value of main products/ services sold in last financial year	Total 83 acres of land, Currently Phase I and Phase 2 consisting of 24 buildings are at different stages of development.
7. Number of employees/ workmen	Information not available
8. Further details including last available financial statements (with schedules) of two years, lists of creditors, relevant dates for subsequent events of the process are available at:	Write to <a href="mailto:eoi.cir.vhpl@gmail.com">eoi.cir.vhpl@gmail.com</a> to obtain such information.
9. Eligibility for resolution applicants under section 25(2)(h) of the Code is available at:	The eligibility criteria are mentioned in the detailed invitation for Expression of Interest to submit Resolution Plan(s) ("Invitation"). Write to <a href="mailto:eoi.cir.vhpl@gmail.com">eoi.cir.vhpl@gmail.com</a> to obtain the Invitation for EOI.
10. Last date for receipt of expression of interest	June 10, 2023 (earlier May 30, 2023)
11. Date of issue of provisional list of prospective resolution applicants	June 20, 2023 (earlier June 09, 2023)
12. Last date for submission of objections to provisional list	June 25, 2023 (earlier June 14, 2023)
13. Process email id to submit EOI	<a href="mailto:eoi.cir.vhpl@gmail.com">eoi.cir.vhpl@gmail.com</a>

Notes:  
1. This is addendum No. II issued to the invitation for expression of interest dated April 10, 2023 and Addendum No. I dated May 11, 2023 respectively. Accordingly, the timelines for submission of EOI and the dates for corresponding events have been extended.  
2. The Committee of Creditors of the Corporate Debtor resolved to replace the Interim Resolution Professional Mr. Akshay M. M. in the meeting held on 29th November 2022. In accordance with Section 23(3) of IBC, 2016. Accordingly, an application was filed, and Hon'ble NCLT, vide its order dated 13th March, 2023 (Order uploaded on 24th March 2023), replaced the Interim Resolution Professional (Deemed Resolution Professional) and appointed Insolvency Professional **Mr. Prakash V. Kukreja** ("RP") as the Resolution Professional.  
3. The Interim Resolution Professional ("IRP") / Resolution Professional ("RP") / Committee of Creditors ("COC") shall have the discretion to change the criteria for the EOI at any point of time.  
4. The IRP/RP/COC reserves the right to cancel or modify the process / application without assigning any reason and without any liability whatsoever.  
5. Detailed Invitation for Expression of Interest (EOI) specifying criteria, eligibility norms under Section 25A of the Code etc., can also be requested through email [eoi.cir.vhpl@gmail.com](mailto:eoi.cir.vhpl@gmail.com)

**Prakash V. Kukreja**  
Insolvency Professional  
Registration Number: (BB)/IPA-001/IP-P02599/2021-2022/13990  
Date: May 31, 2023  
Place: Mumbai

# COMFORT INTECH LIMITED

CIN: L74110DD1994PLC001678

Registered Office: 106, Avkar Alga Nagar, Kalaria, Daman, DD-396210;

Corporate Office: A-301, Hetal Arch, Opp. Natraj Market, S.V. Road, Malad (West), Mumbai-400064;

Phone No.: 022-6694-8500/08/09, Fax: 022-2889-2527; Email: [info@comfortintech.com](mailto:info@comfortintech.com); Website: [www.comfortintech.com](http://www.comfortintech.com)

## EXTRACT OF THE AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND FINANCIAL YEAR ENDED MARCH 31, 2023

(Rs. in Lakh, except EPS)

Sr. No.	Particulars	Quarter ended			Year Ended	
		31.03.2023	31.12.2022	31.03.2022	31.03.2023	31.03.2022
		(Audited)	(Un-Audited)	(Audited)	(Audited)	(Audited)
1	Total Income	3796.34	4263.41	2472.04	16502.81	13251.65
2	Net Profit / (Loss) for the period (before Tax and Exceptional items)	56.55	325.96	194.33	797.19	651.74
3	Net Profit / (Loss) for the period before Tax, (after Exceptional Items)	56.55	325.96	194.33	797.19	651.74
4	Net Profit / (Loss) for the period (after Tax, Exceptional items, and share of Profit/ (Loss) of associates)	(113.08)	250.51	(18.34)	703.73	777.22
5	Total Comprehensive Income/(Loss) for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income/(Loss) (after tax))	(389.86)	441.32	(341.35)	569.94	578.04
6	Equity Share Capital (Face Value Rs. 10/- each) (Refer Note no. 5)	3199.38	3199.38	3199.38	3199.38	3199.38
7	Reserves (excluding revaluation reserve as shown in the Audited Balance Sheet of the previous accounting year)	0	0	0	8632.80	8322.83
8	Earnings Per Share (EPS) Basic & Diluted (par value Rs. 01/- each) (Refer Note no.5)	0.00*	0.08*	0.00*	0.22	0.24

\*Not Annualised

Notes:

- The above is an extract of the detailed format of Audited Consolidated Financial Results for the quarter and financial year ended March 31, 2023 filed with the Stock Exchange under Regulation 32 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results (Standalone and Consolidated) is available on the Company's website at [www.comfortintech.com](http://www.comfortintech.com) and on the website of the Stock Exchange where the Company's shares are listed i.e. at [www.bseindia.com](http://www.bseindia.com).
- The key Audited financial results of Comfort Intech Limited (Standalone Information) is as under:

(Rs. in Lakhs)

Sr. No.	Particulars	Quarter ended			Year Ended	
		31.03.2023	31.12.2022	31.03.2022	31.03.2023	31.03.2022
		(Audited)	(Un-Audited)	(Audited)	(Audited)	(Audited)
1	Total Income from operations	3796.34	4263.41	2472.04	16502.81	13251.65
2	Profit/(Loss) before tax	56.55	325.96	194.33	797.19	651.74
3	Profit/(Loss) for the period	40.81	263.12	139.31	589.17	480.00

- Subsequent to quarter ended 31st March 2023, the equity shares of the company were split/ sub-divided such that each equity share having face value of INR 10/- (Rupees Ten only), fully paid-up, was sub-divided into ten (10) equity shares having face value of INR 1/- (Rupee One) only each, fully paid-up with effect from April 14, 2023 (Record Date). The Earning Per Share (EPS) of the current quarter and at comparative periods presented above have restated to give effect of the share split.
- The Board of Directors of the Company at its meeting held on May 30, 2023 has recommended a final dividend of 0.06/- per equity share (face value Rs. 1/- each) for the financial year ended March 31, 2023, subject to the approval of the equity shareholders at the ensuing Annual General Meeting of the Company.

For and on behalf of the Board of Directors of Comfort Intech Limited

Sd/-  
Apexika Kadam  
Director

Place: Mumbai  
Date: May 30, 2023  
DIN: 08878724

\*Not Annualised  
Notes:  
1. The above is an extract of the detailed format of Audited Consolidated Financial Results for the quarter and financial year ended March 31, 2023 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results (Standalone and Consolidated) is available on the Company's website at [www.comfortintech.com](http://www.comfortintech.com) and on the website of the Stock Exchange where the Company's shares are listed i.e. at [www.bseindia.com](http://www.bseindia.com).  
2. The key Audited financial results of Comfort Intech Limited (Standalone Information) is as under:

(Rs. in Lakhs)					
Sr. No.	Particulars	Quarter ended 31.03.2023 (Audited)	Quarter ended 31.12.2022 (Un-Audited)	Quarter ended 31.03.2022 (Audited)	Quarter ended 31.03.2023 (Audited)
1	Total Income from operations	3796.34	4263.41	2472.04	16502.81
2	Profit/(Loss) before tax	56.55	325.96	194.33	797.19
3	Profit/(Loss) for the period	40.81	263.12	139.31	589.17

3. Subsequent to quarter ended 31st March 2023, the equity shares of the Company were split/sub-divided such that each equity share having face value of INR 10/- (Rupees Ten only), fully paid-up, was sub-divided into ten (10) equity shares having face value of INR 1/- (Rupee One only) each, fully paid-up with effect from April 14, 2023 (Record Date). The Earning Per Share (EPS) of the current quarter and all comparative periods presented above have restated to give effect of the share split.  
4. The Board of Directors of the Company at its meeting held on May 30, 2023 has recommended a final dividend of 0.06/- per equity share (face value Rs. 1/- each) for the financial year ended March 31, 2023, subject to the approval of the equity shareholders at the ensuing Annual General Meeting of the Company.

For and on behalf of the Board of Directors of Comfort Intech Limited  
Sd/-  
Apeksha Kadam  
Director  
DIN: 08878724

Year Ended March 31, 2023					
[Regulation 52 (8), read with regulation 52 (4) of the Listing Regulations] (Rupees in crore)					
Sl. No.	Particulars	Quarter Ended		Year Ended	
		31-Mar-23 (Unaudited)	31-Mar-22 (Unaudited)	31-Mar-23 (Audited)	31-Mar-22 (Audited)
1	Total Income from Operations	37.14	(78.49)	164.54	195.95
2	Net Profit / (Loss) for the period (before Exceptional and/or Extraordinary items)	154.67	(4,404.89)	(242.22)	(7,103.23)
3	Net Profit / (Loss) for the period before Tax	2,052.10	(4,404.89)	4,043.72	(7,103.19)
4	(after Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period after Tax (after Tax, Exceptional and/or Extraordinary items)	2,052.10	(4,395.47)	4,043.36	(7,079.34)
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	690.10	(4,395.16)	4,672.82	(7,079.13)
6	Paid-up Equity Share Capital	135.33	135.33	135.33	135.33
7	Reserves (excluding Revaluation Reserve)	(6,242.37)	(10,915.19)	(6,242.37)	(10,915.19)
8	Securities Premium Account	2,078.11	2,078.11	2,078.11	2,078.11
9	Net Worth	(3,249.11)	(10,379.86)	(3,249.11)	(10,379.86)
10	Paid-up Debt Capital / Outstanding Debt	3,841.01	9,832.72	3,841.01	9,832.72
11	Outstanding Redeemable Preference Shares	0.14	0.14	0.14	0.14
12	Debt Equity Ratio	(1.18)	(0.95)	(1.18)	(0.95)
13	Earnings Per Share (of Rs. 10/- each fully paid-up) ** Basic & Diluted (Rs.)	151.64	(324.81)	298.79	(523.13)
14	Capital Redemption Reserve	Not Applicable	Not Applicable	Not Applicable	Not Applicable
15	Debt Redemption Reserve	#	#	#	#
16	Debt Service Coverage Ratio	Not Applicable	Not Applicable	Not Applicable	Not Applicable
17	Interest Service Coverage Ratio	Not Applicable	Not Applicable	Not Applicable	Not Applicable
# - Exceptional and/or Extraordinary items adjusted in the statement of Profit & Loss in accordance with Ind AS Rules/AS Rules, whichever is applicable.					
Notes :					
a) The above is an extract of the detailed format of quarterly/annual financial results filed with the Stock Exchange(s) under Regulation 52 of the Listing Regulations. The full format of the quarterly/annual financial results is available on the websites of the Stock Exchange(s) and the listed entity.					
b) For the other line items referred to in Regulation 52(4) of the Listing Regulations, pertinent disclosures have been made to BSE Limited and can be accessed on the website of the Stock Exchange i.e. www.bseindia.com.					
c) The impact on net profit/loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote.					
** Not Annualised for Quarters					
# No DRR is required in respect of privately placed debentures in terms of Rule 18(7)(b)(i) of the Companies (Share Capital and Debentures) Rules, 2014.					
For Reliance Commercial Finance Limited (Wholly owned Subsidiary of Authem Investment & Infrastructure (Private) Limited) Sd/- Amit Dangri Director DIN: 065270044					
Date: May 31, 2023 Place: Mumbai					

# - Exceptional and/or Extraordinary items adjusted in the statement of Profit & Loss in accordance with Ind AS Rules/AS Rules, whichever is applicable.  
NOTES:  
a) The above is an extract of the detailed format of quarterly/annual financial results filed with the Stock Exchange(s) under Regulation 52 of the Listing Regulations. The full format of the quarterly/annual financial results is available on the websites of the Stock Exchange(s) and the listed entity.  
b) For the other line items referred to in Regulation 52(4) of the Listing Regulations, pertinent disclosures have been made to BSE Limited and can be accessed on the website of the Stock Exchange i.e. [www.bseindia.com](http://www.bseindia.com).  
c) The impact on net profit/loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote.  
\*\* Not Annualised for Quarters  
# No DRR is required in respect of privately placed debentures in terms of Rule 18(7)(b)(i) of the Companies (Share Capital and Debentures) Rules, 2014.

For Reliance Commercial Finance Limited  
(Wholly owned Subsidiary of Authum Investment & Infrastructure Limited)  
Sd/-  
Amit Dangl  
Director  
DIN: 06527044

<b>SUYOG GURBAXANI FUNICULAR ROPEWAYS LIMITED</b> CIN: L45203MH2010PLC200005 Registered office: 18, Suyog Industrial Estate, 1st Floor, LBS Marg, Vikhroli (West) Mumbai- 400083 Tel No.: 022-25795516/ 25778029   Website: <a href="http://www.sgfrl.com">www.sgfrl.com</a>   Email id: <a href="mailto:sgfrpl@gmail.com">sgfrpl@gmail.com</a>					
<b>AUDITED FINANCIAL RESULTS FOR THE HALF YEAR AND YEAR ENDED 31ST MARCH 2023</b> (₹ in Hundreds)					
Particulars	Standalone		-		
	Six Months Ended October 1, 2022 to March 31, 2023	Preceding Six Months Ended April 1, 2022 to September 30, 2022	Corresponding Six Months Ended October 1, 2021 to March 31, 2022	Year to date figures for the current period ended April 1, 2022 to March 31, 2023	Year to date figures for the current period ended April 1, 2021 to March 31, 2022
	Audited	Unaudited	Audited	Audited	Audited
<b>I. Income from Operations</b>					
(a) Revenue from Operations	11,74,272.79	6,26,296.96	8,05,240.91	18,00,569.75	8,05,240.91
(b) Other Income	(13,601.23)	15,604.68	775.76	2,003.45	775.76
<b>II. Total Income</b>	<b>11,60,671.56</b>	<b>6,41,901.64</b>	<b>8,06,016.67</b>	<b>18,02,573.20</b>	<b>8,06,016.67</b>
<b>Total Expenses</b>	<b>10,69,688.09</b>	<b>7,32,054.98</b>	<b>9,82,295.03</b>	<b>18,01,743.07</b>	<b>14,99,613.28</b>
<b>III. Profit / (Loss) from operations before exceptional</b>	-	-	-	-	-
<b>IV. Exceptional Items</b>	-	-	-	-	-
<b>V. Profit Before Tax (III - IV)</b>	<b>90,983.47</b>	<b>(90,153.34)</b>	<b>(1,76,278.36)</b>	<b>830.13</b>	<b>(6,93,596.61)</b>
<b>VI. Tax Expenses</b>					
(a) Current Tax	-	-	-	-	-
(b) Deferred Tax	(30,561.13)	-	-	(30,561.13)	-
<b>VII. Profit/(Loss) for the period from continuing operations (V - VI)</b>	<b>1,21,544.61</b>	<b>(90,153.34)</b>	<b>(1,76,278.36)</b>	<b>31,391.27</b>	<b>(6,93,596.61)</b>
<b>VIII. Profit/(Loss) for the period (VIII + X)</b>	<b>1,21,544.61</b>	<b>(90,153.34)</b>	<b>(1,76,278.36)</b>	<b>31,391.27</b>	<b>(6,93,596.61)</b>
<b>XI. Details of Equity Share Capital</b>					
Paid-up equity share capital	24,86,222.20	24,86,222.20	23,36,222.20	24,86,222.20	24,86,222.20
<b>Face value of equity share capital</b>	<b>10.00</b>	<b>10.00</b>	<b>10.00</b>	<b>10.00</b>	<b>10.00</b>
<b>X. Earning per Equity shares</b>					
<b>(1) Basic earnings per equity share</b>	<b>0.0049</b>	<b>-0.0036</b>	<b>(0.01)</b>	<b>0.0013</b>	<b>(0.05)</b>
<b>(2) Diluted earnings per equity share</b>	<b>0.0049</b>	<b>-0.0036</b>	<b>(0.01)</b>	<b>0.0013</b>	<b>(0.05)</b>

Note:  
1. The above Standalone results have been reviewed by Audit Committee and taken on record by the Board of Directors in their meeting held on May 29, 2023. The Report of Statutory Auditors is being filed with the Bombay Stock Exchange and the same is available on Company's website.  
2. The Company has been awarded the work to design, engineer, procure, finance, construct, operate and maintain Funicular Ropeway on Build, Operate & Transfer (BOT) basis at Sapatsshrungi Gad, Vani, Kallwan, Nashik, and to charge and collect the toll fees as per Concession Agreement dated 12.01.2010, executed with Government of Maharashtra, Public Works Department, and in the Managements Opinion this is the only segment and hence there are no separate reportable segment as per AS-17 on "Segment Reporting".  
3. These results have been prepared in accordance with SEBI Listing Regulations and SEBI Circulars issued from time to time, applicable Accounting Standards and Companies Act 2013 read with the relevant rules issued thereunder and other accounting principles generally accepted in India.  
4. Previous year figure has been rearranged / regrouped wherever necessary, to correspond with those of the current periods' classification.  
5. The above results of the Company are available on the Company's website [www.sgfrl.com](http://www.sgfrl.com) and also on [www.bseindia.com](http://www.bseindia.com).

On behalf of Board of Directors  
Suyog Gurbaxani Funicular Ropeways Limited  
Sd/-  
(Rajkumar Gurbaxani)  
Managing Director  
DIN 00324101


Date: May 30, 2023  
Place: Mumbai

<b>ICICI Prudential Asset Management Company Limited</b> Corporate Identity Number: U99999DL1993PLC054135 Registered Office: 12 <sup>th</sup> Floor, Narain Manzil, 23, Barakhamba Road, New Delhi - 110 001. Corporate Office: One BKC, 13 <sup>th</sup> Floor, Bandra Kurla Complex, Mumbai - 400 051. Tel.: +91 2
--



PRASHANT INDIA LIMITED				
REGD. OFFICE- BLOCK NO 456 PALSANA CHARRASTA PALSANA DIST SURAT  GJ 394315 PH-7228086858 CIN: L15142G1983PLC006574, Email Id:cs.prashantindia@gmail.com, Website:www.prashantindia.info				
STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS  FOR THE QUARTER AND YEAR ENDED 31.03.2023				
(Rs. In lakhs)				
Particulars	Quarter ended 31.03.2023 Audited	Quarter ended 31.03.2022 Audited	Year ended 31.03.2023 Audited	Year ended 31.03.2022 Audited
Total income from operations	23.38	38.34	103.85	108.55
Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	(5.64)	3.77	(16.65)	(15.07)
Net Profit / (Loss) for the period before tax( after Exceptional and/or Extraordinary Items)	(19.42)	3.09	(24.39)	(15.75)
Net Profit / (Loss) for the period after tax(after Exceptional and/or Extraordinary Items)	(19.42)	3.09	(24.39)	(15.75)
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(19.42)	3.09	(24.39)	(15.75)
Equity Share Capital	423.54	423.54	423.54	423.54
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)			(3,688.95)	(3684.58)
Earnings Per Share (of Rs. 10/- each) Basic & Diluted :	(0.46)	0.07	(0.58)	(0.37)
Note: The above is an extract of the detailed Quarterly and yearly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the same are available on the Stock Exchange websites at www.bseindia.com and on Company's Website at www.prashantindia.info For Prashant India Limited Sd/- Prashubdas M. Gondalia Managing Director (DIN:00014809)				

Sumeet INDUSTRIES LIMITED				
EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31/03/2023				
( ₹ In Lakh)				
Sr. No	Particulars	QUARTER ENDED		YEAR ENDED
		31/03/2023 Audited	31/03/2022 Audited	31/03/2023 Audited
1	Total Income from operations (net)	24707.12	28591.61	104334.98
2	Net Profit / (Loss) for the period before Tax and Exceptional items	386.80	-1357.24	-6375.16
3	Net Profit / (Loss) for the period before tax after Exceptional items	385.00	-1360.79	-6376.96
4	Net Profit / (Loss) for the period after tax and Exceptional items	508.59	-789.88	-5872.15
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	528.55	-761.57	-5851.82
6	Paid up Equity Share Capital	10364.24	10364.24	10364.24
7	Other Equity excluding Revaluation Reserves	-	-	-
8	Earnings Per Share (of Rs. 10/- each not annualised) (for continuing and discontinued operations)	0.49	-0.73	-5.67
1.	Basic	-	-	-
2.	Diluted	-	-	-
NOTE :- 1. The above is an extract of the detailed format of Audited Financial Results for the quarter and year ended 31.03.2023, filed with the Stock Exchange(s) under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the website of the Stock Exchange(s) BSE: www.bseindia.com and NSE: www.nseindia.com and website of the Company: www.sumeetindustries.com. 2. The Corporate Insolvency Resolution Process ["CIRP"] of Sumeet Industries Limited ["SIL"] has been initiated vide the Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench ["NCLT"], order dated 20.12.2022, under Section 7 of the Insolvency and Bankruptcy Code, 2016 ["IBC"/ "Code"], filed by IDBI Bank Limited. Mr. Satyendra P. Khorania (Reg. No. IBBI/IPA-002/IP-N00002/2016-17/10002) has been appointed as Resolution Professional ("RP") of the company. For SUMEET INDUSTRIES LIMITED (under CIRP) Anil Kumar Jain Company Secretary PLACE : Surat DATE : 30/05/2023 CIN No. L45200GJ1988PLC011049 Regd. Office : 504, Trividh Chambers, Opp. Fire Station, Ring Road, Surat - 395 002. India. E-mail : corporate@sumeetindustries.com, Visit us at : www.sumeetindustries.com				

 <b>kotak</b> Kotak Mahindra Bank		રજીસ્ટર્ડ ઓફિસ : ૩૦ બીકીટી, રો ૩૦, ૩૭ બ્લોક, બાંધા કુરુલા કોમ્પ્લેક્સ, બાંધા (પૂર્વ), મુંબઈ - ૪૦૦૦૫૧. (ફોન)૩૨૨ આઈડીઆઈ.નં. : L55110M1985PLC038137) સેલ્યુલર ઓફિસ : કોલકેન્ટ્રેશન બ્લોક લી., સોમો મામા, રિક્ષા કોમ્પ્લેક્સ, સીપ વર્કસ બેંચ રોડ પાસે, સેલ્યુલર, અમદાવાદ - ૩૮૦૦૧૫		<b>ઈ-દરજી કમ વેબાશ માટે જાહેર નોટીસ</b>	
ગણી, જાહેર જનતાને સમાવેશ રહે તેમાં ખાસ કરીને ઉદારકર્તા /સા.ઉદારકર્તા /જમીનદાર ગણનારને નોટીસ આપવામાં આવે છે કે નીચે દર્શાવેલ ગણનાથી મિલકતો મુકદ્દમ દાખલમાં મોરગા/માર્ગ કરેલ જેનો પ્રત્યક્ષ કબજો કોલેક્ટ મહિના બેઠક લીમીટેડ મુકદ્દમ દાખલમાં કમ્પીટીવ યાદીમાં રહેલ છે. જેનું વેચાણ "વ્યાજ છે વ્યાજ છે", "વે છે તે છે" અને "જેવી છે તેવી છે" ના ધોરણે કરવામાં આવશે. ગણના ઈ-ઑક્શન સર્વિસ પોર્ટલના ના વેબ પોર્ટલ દ્વારા ગણનાદાર સમગ્રી સ્વચ્છ ઓફર આપીને કરવામાં આવે છે. એ.એમ.ઈન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ એવેલ છે ક્ષાવર મિલકતના વેચાણ માટે નીચે સહી કરનાર દ્વારા <a href="http://www.c1india.com">www.c1india.com</a> માસ્ટર જેની વિગતો નીચે મુજબ છે.					
૧) ઉદારકર્તા(ઓ) / જમીનદાર (રો) / ગિરવેદાર(રો)ના નામ		મોંઘાણા નોટીસ તારીખ અને ક્રિમિટ	સ્થાવર મિલકતનું વર્ણન	અનામત ક્રિમિટ	અર્જેસ્ટ મની ડીપોઝિટ (ઈએમડી)
૧. અંજની લિંગેર (ઉદારકર્તા)		તા. ૧૦.૦૫.૨૦૧૬	મિલકત આરએસ નં. ૩૨૩ + ૩૨૨૩/૩, સળ વોટ નં. ૩૭, અંજિલા નગર સોસાયટી, રિષ્ઠા હાઉસીંગ સોસાયટી પાછળ, ૨૨ ગામ સ્કુલ પાસે, કરમસાઈ, વી.વી. નગર, આઈઆ - ૩૮૦૦૦૧ ખાતે આવેલ સમગ્ર મિલકત.	૩૩,૧૮,૦૦૦/- (રૂપિયા ત્રીસ લાખ અઠાર હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૨. અતુલકુમાર જશભાઈ પટેલ (જમીનદાર) (લોન એકાઉન્ટ નં. RH8255068)		તા. ૧૧,૦૦,૬૮૩, ૨૫/-	મિલકત આરએસ નં. ૩૨૩ + ૩૨૨૩/૩, સળ વોટ નં. ૩૭, અંજિલા નગર સોસાયટી, રિષ્ઠા હાઉસીંગ સોસાયટી પાછળ, ૨૨ ગામ સ્કુલ પાસે, કરમસાઈ, વી.વી. નગર, આઈઆ - ૩૮૦૦૦૧ ખાતે આવેલ સમગ્ર મિલકત.	૩૩,૧૮,૦૦૦/- (રૂપિયા ત્રીસ લાખ અઠાર હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
સ્થાવર મિલકતની નિર્દિશાઓ તારીખ : ૦૩.૦૭.૨૦૨૩, સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ કલાકે		મોંઘાણા નોટીસ તારીખ અને ક્રિમિટ	સ્થાવર મિલકતનું વર્ણન	અનામત ક્રિમિટ	અર્જેસ્ટ મની ડીપોઝિટ (ઈએમડી)
૩) ઉદારકર્તા(ઓ) / જમીનદાર (રો) / ગિરવેદાર(રો)ના નામ		મોંઘાણા નોટીસ તારીખ અને ક્રિમિટ	સ્થાવર મિલકતનું વર્ણન	અનામત ક્રિમિટ	અર્જેસ્ટ મની ડીપોઝિટ (ઈએમડી)
(૧) મણીમદ ફેરજા (ઉદારકર્તા)		તા. ૦૮.૦૮.૨૦૨૧	ફુલ્ગા નં. ૩૪ અને પડ. રેશમવાલા માર્કેટ, રિંગ રોડ, સુરત - ૩૮૦૦૧૬	૧,૧૮,૦૦,૦૦૦/- (રૂપિયા એક કરોડ અઠાર લાખ ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
(૨) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૧૩.૦૫.૨૦૨૧	ફુલ્ગા નં. ૩૪ અને પડ. રેશમવાલા માર્કેટ, રિંગ રોડ, સુરત - ૩૮૦૦૧૬	૧,૧૮,૦૦,૦૦૦/- (રૂપિયા એક કરોડ અઠાર લાખ ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
(૩) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૧૩.૦૫.૨૦૨૧	ફુલ્ગા નં. ૩૪ અને પડ. રેશમવાલા માર્કેટ, રિંગ રોડ, સુરત - ૩૮૦૦૧૬	૧,૧૮,૦૦,૦૦૦/- (રૂપિયા એક કરોડ અઠાર લાખ ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
(૪) અર્જેસ્ટ મની ડીપોઝિટ (ઈએમડી) નામ		તા. ૧૩.૦૫.૨૦૨૧	ફુલ્ગા નં. ૩૪ અને પડ. રેશમવાલા માર્કેટ, રિંગ રોડ, સુરત - ૩૮૦૦૧૬	૧,૧૮,૦૦,૦૦૦/- (રૂપિયા એક કરોડ અઠાર લાખ ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
સ્થાવર મિલકતની નિર્દિશાઓ તારીખ : ૧૬.૦૬.૨૦૨૩, સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ કલાકે		મોંઘાણા નોટીસ તારીખ અને ક્રિમિટ	સ્થાવર મિલકતનું વર્ણન	અનામત ક્રિમિટ	અર્જેસ્ટ મની ડીપોઝિટ (ઈએમડી)
૩) ઉદારકર્તા(ઓ) / જમીનદાર (રો) / ગિરવેદાર(રો)ના નામ		મોંઘાણા નોટીસ તારીખ અને ક્રિમિટ	સ્થાવર મિલકતનું વર્ણન	અનામત ક્રિમિટ	અર્જેસ્ટ મની ડીપોઝિટ (ઈએમડી)
લોન એકાઉન્ટ નં. માટે RH82718 & RH82720		તા. ૨૧.૧૨.૨૦૧૮	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૨) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૩) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૪) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૫) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૬) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૭) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૮) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૯) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૧૦) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૧૧) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૧૨) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૧૩) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૧૪) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૧૫) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૧૬) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૧૭) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૧૮) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૧૯) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૨૦) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૨૧) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૨૨) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૨૩) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૨૪) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૨૫) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૨૬) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૨૭) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૨૮) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૨૯) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૩૦) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૩૧) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૩૨) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ ઓફ બરોડા સામે, પાણોનીચર હાઉસિંગ સોસાયટી પાછળ, વડોદરા (લોન ખાતા નં. RH82718 & RH82720) માટે	૭૫,૬૦,૦૦૦/- (રૂપિયા પંચોતેર લાખ સોઈસ હજાર ફક્ત)	બીડીની રકમના ૧૦% સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધી
૩૩) રાજીવ સુરજા (જમીનદાર)		તા. ૨૬.૦૩.૨૦૨૧	ફલેટ નં. આઈ-૧૦૧, ૧૦૨, પહેલી માળ, ટાવર આઈ, ડવ ડેક, અમેરિકન સ્કુલ		